

બાળકો અને 65થી ઓછી ઉંમરના પુખ્તો

NJ ફેમિલીકેર એ NJના રહીશો માટે સાર્વજનિક ભંડોળ મેળવતું સ્વાસ્થ્ય કવરેજ છે. તે મફત અથવા ઓછા દરની ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્યસંભાળ પૂરી પાડે છે. NJ ફેમિલીકેર કાર્યક્રમમાં CHIP, મેડિકેડ અને મોડિકેડ વિસ્તરણ વસ્તીઓનો સમાવેશ થાય છે.

કોને આવરી લેવામાં આવે છે?

NJ ફેમિલીકેર રાજ્ય દ્વારા કરારબદ્ધ સ્વાસ્થ્ય યોજનાઓ દ્વારા પૂર્ણ સ્વાસ્થ્યસંભાળ કવરેજ આપે છે. NJ FamilyCare નીચેના સહિતની મોટાભાગની સ્વાસ્થ્યસંભાળની જરૂરિયાતો આવરી લે છે:

- ડોક્ટરની મુલાકાતો
- ઍક્સ-રે
- યશમાં
- પ્રીસ્ક્રિપ્શન્સ
- હોસ્પિટલમાં ભરતી
- માનસિક સ્વાસ્થ્ય સેવાઓ
- પ્રયોગશાળા પરીક્ષણો
- ડેન્ટલ
- નિષ્ણાતની મુલાકાતો

કોણ લાયક છે:

કોઈપણ ઉંમરના લાયક NJ રહીશો NJ ફેમિલીકેર માટે લાયક હોઈ શકે છે. આમાં બાળકો, માતાપિતા, પાલક સંબંધીઓ અને આશ્રિત બાળકો વિનાના પુખ્તોનો સમાવેશ થાય છે. યોગ્યતા આવક અને ઘરના કદ પર આધારિત હોય છે જે અરજદારના તાજેતર ફેડરલ ટેક્સ રિટર્નમાં નોંધાઈ હોય. જોકે, NJ ફેમિલીકેર માહિતીની ખરાઈ કરવા માટે પગારની રસીદો જેવા અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરી શકે છે. બાળકો માટે આવકની યોગ્યતા પુખ્તો માટે આવકની યોગ્યતા કરતા વધારે હોય છે. (જુઓ ચાર્ટ)

તેમાં કેટલો ખર્ચ થાય છે?

ઘણાં લોકો માટે, NJ ફેમિલીકેરમાં કોઈ ખર્ચ થતો નથી: કોઈ માસિક પ્રીમિયમ અથવા સહ-ચૂકવણીઓ નહીં. બાળકો ધરાવતા વધુ આવકના કુટુંબો માટે સહ-ચૂકવણીઓ અને માસિક પ્રીમિયમ માટે સ્લાઈડિંગ સ્કેલ છે.

શું કોઈપણ અંકુશો છે?

પહેલેથી હાજર હોય તેવી સ્થિતિઓ લાયકાતને અસર કરતી નથી. મોટાભાગના કિસ્સાઓમાં, બાળકો લાયક સાબિત થઈ શકે તે માટે તેઓ ઓછામાં ઓછા 3 મહિના માટે મેડિકલ વીમારહિત હોવા જોઈએ. અપવાદો હોવાને કારણે, તમને પ્રશ્ન હોય તો NJ ફેમિલીકેરને કોલ કરવો જોઈએ.

પુખ્ત વ્યક્તિઓ લાયક સાબિત થઈ શકે તે માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે કાનૂની કાયમી નિવાસી તરીકેનો દરજ્જો ધરાવતા હોવા જોઈએ. બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ અમેરિકામાં તેમના પ્રવેશની તારીખ સાથે કોઈ સંબંધ વિના લાયક ગણાઈ શકે છે, જો તેઓ કાનૂની રહીશો હોય. નોંધાયા ન હોય તેવા રહીશો માટે, તેમના બાળકો અમેરિકામાં જન્મ્યાં હોય તો લાયક હોઈ શકે છે.

વધુ માહિતી કેવી રીતે મેળવવી?

તમે લાયક છો કે નહીં તે શોધવા માટે અથવા વધુ માહિતી માટે કોલ કરો અથવા અમારી વેબસાઈટની મુલાકાત લો.

www.njfamilycare.org ઓનલાઈન અરજી કરો!

1-800-701-0710

(બહુભાષી ઓપરેટરો ઉપલબ્ધ છે)

TTY 1-800-701-0720

(અધિર વ્યક્તિઓ માટે)

NJ FamilyCare, લાગુ પડતા ફેડરલ નાગરિક અધિકાર કાયદાઓનું પાલન કરે છે અને જાતિ, રંગ, રાષ્ટ્રીય મૂળ, લિંગ, વય અથવા અપંગતાને આધારે ભેદભાવ કરતું નથી. જો તમે ગુજરાતી બોલતા હોવ તો ભાષા સહાય સેવાઓ તમારે માટે નિ:શુલ્ક ઉપલબ્ધ છે. ફોન કરો 1-800-701-0710 (TTY: 1-800-701-0720).

જાન્યુઆરી 1, 2017 પ્રમાણે મહત્તમ માસિક આવક

કુટુંબનું કદ અને તમારા ફેડરલ ટેક્સ પર નોંધાયેલી માસિક આવક			
કુટુંબનું કદ*	બાળકો (19થી ઓછી ઉંમર)	માતાપિતા અને અપરિણીત પુખ્તો (ઉંમર 19-64)	ગર્ભવતી મહિલાઓ (કોઈપણ ઉંમર)
1	\$ 3,568	\$ 1,387	લાગુ નથી
2	\$ 4,805	\$ 1,868	\$ 2,775
3	\$ 6,041	\$ 2,349	\$ 3,489
4	\$ 7,278	\$ 2,829	\$ 4,203
5	\$ 8,515	\$ 3,310	\$ 4,917
6	\$ 9,751	\$ 3,791	\$ 5,631
પ્રત્યેક વધારાનો સભ્ય	\$ 1,237	\$ 481	\$ 715

* તમારા કુટુંબનું કદ માતાપિતા અથવા પાલક(કો) અને જેઓ કર આશ્રિત હોય તેવા 21થી ઓછી ઉંમરના લોકોની સગાઈ ધરાવતા બધા બાળકો તેમજ તમારા ઘરમાં રહેતા અન્ય કર આશ્રિતની કુલ સંખ્યા દ્વારા નક્કી કરવામાં આવી શકે છે.